



**Bhakta Kavi Narsinh Mehta University**  
Govt. Polytechnic College Compus, Bhakta Kavi Narsinh Mehta University Road,  
Khadiya, Junagadh  
Ph. : (O) 0285-2681400 Fax : (0285) 2681503  
Website : <http://www.bknmu.edu.in>

### પરિપત્ર

વિષય :- આગામી માર્ચ/એપ્રિલ - ૨૦૧૯ માં લેવાનાર યુ.જી. સેમ- ૨(ALL-OLD/NEW) ના વિદ્યાર્થીનાં પરીક્ષા ફોર્મની ઓનલાઇન એન્ટ્રી તા. ૧૯/૦૩/૨૦૧૯ થી શરૂ કરવા બાબત.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન સર્વે સંસ્થાના વડાશ્રીઓને તેમજ માન.આચાર્યશ્રીઓ જણાવવાનું કે, માર્ચ/એપ્રિલ - ૨૦૧૯ માં લેવાનાર યુ.જી.સેમ- ૨(ALL-OLD/NEW) ના વિદ્યાર્થીના પરીક્ષા ફોર્મની ઓનલાઇન એન્ટ્રી તા.૧૯/૦૩/૨૦૧૯ થી ૨૯/૦૩/૨૦૧૯ સુધી કરી શકાશે તે અંગે સંબંધિત ભવન - કોલેજ દ્વારા તેમના લોગીન મારફત એન્ટ્રી કરવાની રહેશે.

૧	યુ.જી. સેમ- ૨(ALL-OLD/NEW) પરીક્ષા ફોર્મની ઓનલાઇન એન્ટ્રી	રેગ્યુલર ફી સાથે તા.૧૯/૦૩/૨૦૧૯ થી તા.૨૯/૦૩/૨૦૧૯	લેઇટ ફી સાથે ફી + રૂ.૫૦૦/- તા.૨૯/૦૩/૨૦૧૯	ઠંડાત્મક ફી સાથે ફી + રૂ.૫૦૦/- + રૂ.૧૫૦૦/- તા.૩૦/૦૩/૨૦૧૯
---	---	---	--	--

ઓનલાઇન પ્રોગ્રામમાં એન્ટ્રી કર્યા બાદ જરૂરી સુધારો સમય-મર્યાદામાં કરવાનો રહેશે. છેલ્લી તારીખ બાદ સુધારો થઈ શકશે નહિ. ડિગ્રી ફોર્મ માટે ઓનલાઇન એન્ટ્રી તારીખ હવે પછીથી જાહેર કરવામાં આવશે.

નોંધ : કોલેજ દ્વારા યુ.જી. સેમ- ૨(ALL-OLD/NEW) ની પરીક્ષાઓની ઓનલાઇન એન્ટ્રી કરવાની લેઇટ ફી સાથેની છેલ્લી તારીખ તેમજ ઠંડાત્મક ફી સાથેની છેલ્લી તારીખ બાદ દિવસ બે (૦૧/૦૪/૨૦૧૯)માં ફી મેમો, ચેકલિસ્ટ, બાંહેધરી પત્ર તથા પરીક્ષા ફી ભર્યાની રસીદ પરીક્ષા વિભાગમાં આપવાની રહેશે. પરીક્ષાના ફોર્મ કોલેજ પોતાની પાસે (રેકોર્ડ)માં રાખવાના રહેશે જરૂર પડ્યે યુનિવર્સિટી દ્વારા મંગાવવામાં આવે તો રજૂ કરવાનાં રહેશે. તેમજ પરીક્ષા ફી “રજીસ્ટ્રાર, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ” ના નામનાં ડીમાન્ડ ડ્રાફ્ટ દ્વારા જ ચૂકવી શકાશે.

ખાસ જણાવવાનું કે, ઓનલાઇન એન્ટ્રી કરવાની લેઇટ ફી સાથેની છેલ્લી તારીખ (ફી + રૂ.૫૦૦) તેમજ ઠંડાત્મક ફી સાથેની છેલ્લી તારીખ (ફી + રૂ. ૫૦૦ + રૂ. ૧૫૦૦) બાદ કરવામાં આવતી એન્ટ્રી સોફ્ટવેર પ્રોગ્રામ સ્વીકારશે નહીં, જે ધ્યાને લેવા વિનંતી છે.

નોંધ:- ૧) દરેક કોલેજ વિદ્યાર્થીએ જે પરીક્ષા ફોર્મમાં વિષય દર્શાવેલા હોય તે જ વિષયની સોફ્ટવેરમાં એન્ટ્રી કરવી. પરીક્ષા ફોર્મ ભર્યા બાદ વિષયમાં ફેરફાર કરી આપવામાં આવશે નહીં. જેથી કાળજીપૂર્વક ફોર્મ ભરવું.

૨) કોલેજ દ્વારા પરીક્ષા ફોર્મની એન્ટ્રી થયા બાદ ફરજિયાત વેરીફાય (verify) કરી લેવાનું રહેશે.

*Dr. Bhikharadey*

પરીક્ષા નિયામક

ક્રમાંક/બીકેએનએમયુ/પરીક્ષા /૦૨/૬૧૪૫/૨૦૧૯

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,

ગવર્નમેન્ટ પોલીટેકનીક કેમ્પસ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ,

ખડીયા, જૂનાગઢ-૩૬૨૨૬૩

તા.૧૯/૩/૨૦૧૯

પ્રતિ,

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓ/પી.જી.સેન્ટરના વડાઓ તરફ...

નકલ સાદર રવાના:-

(૧) માન.કુલપતિશ્રી/ કુલસચિવશ્રીના અંગત સચિવશ્રી,

નકલ રવાના જાણ તથા યોગ્ય કાર્યવાહી અર્થે:-

(૧) આઈ.ટી. સેલ જરૂરી કાર્યવાહી અર્થે અને વેબસાઈટ પર પ્રસિધ્ધ થવા અર્થે અને યોગ્ય કાર્યવાહી અર્થે.

(૨) એકાઉન્ટ શાખામાં જાણ અર્થે.